

સ્પેશિયાલિસ્ટ હાઈ સ્કૂલ્સ મેજર્સ

સ્ટુડન્ટ સક્સેસ પ્રસ્તાવ દ્વારા ઓન્ટારિયો માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓની વ્યક્તિગત કેળવણી શૈલીઓ અને રૂચિઓ પૂરી કરવામાં મદદ કરવા માટે વિસ્તારિત કાર્યક્રમો આપી રહી છે. આ કાર્યક્રમો વિદ્યાર્થીઓને વિવિધ નવા અને સુધારેલા કેળવણીના વિકલ્પો દ્વારા તેમના હાઈ સ્કૂલના અનુભવોને રૂચિ પ્રમાણે ઢાળવા દે છે. આ વિકલ્પોમાં ડ્યુઅલ ક્રેડિટ્સ, સ્પેશિયાલિસ્ટ હાઈ સ્કૂલ્સ મેજર્સ અને સહકારી શિક્ષણનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમો બધાં વિદ્યાર્થીઓની જરૂરિયાતો, રૂચિઓ અને શક્તિઓ પૂર્ણ કરવામાં તેમને કેળવણીમાં પ્રવૃત્ત કરવામાં અને સ્નાતક તેમજ તેથી આગળના સમય માટે તેમને બહેતર રીતે તૈયાર કરવામાં મદદ કરે છે.

સ્પેશિયાલિસ્ટ હાઈ સ્કૂલ્સ મેજર્સ (SHSM) શું છે?

SHSM એ મંત્રાલય માન્ય વિશેષ કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓને માધ્યમિક શાળામાંથી સ્નાતક થવાની જરૂરિયાતો પૂર્ણ કરવા દરમિયાન ચોક્કસ આર્થિક ક્ષેત્ર અંગે તેમની કેળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા દે છે. તે સ્નાતક થયા બાદ એપ્રેન્ટાઈસશિપ તાલીમ, કોલેજ, યુનિવર્સિટી કે અન્ય કાર્યસ્થળ પર તેમના ગમનમાં પણ મદદ કરે છે.

2012-13નાં શાળાકીય વર્ષ પ્રમાણે, SHSMs નીચેના ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે:

- કૃષિ
- આતિથ્ય અને પ્રવાસન
- કળા અને સંસ્કૃતિ
- ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશન્સ ટેકનોલોજી
- એવિએશન/એરોસ્પેસ
- ન્યાય, સમુદાય સલામતી અને આપાતકાલીન સેવાઓ
- વ્યાપાર
- ઉત્પાદન
- બાંધકામ
- ખાણકામ
- ઊર્જા
- લાભ નિરપેક્ષ
- પર્યાવરણ
- રમત
- ફૂડ પ્રોસેસિંગ
- વાહનવ્યવહાર
- ફેરિસ્ટ્રી
- સ્વાસ્થ્ય અને સુખાકારી
- હોટિકલ્ચર અને લેન્ડસ્કેપિંગ

સ્પેશિયાલિસ્ટ હાઈ સ્કૂલ્સ મેજર્સના ચાવીરૂપ લાભો

SHSM કરવાથી વિદ્યાર્થીઓને નીચેનામાં મદદ મળે છે:

- તેમના રસ અને કૌશલ્યને અનુરૂપ બને તે રીતે માધ્યમિક શાળા શિક્ષણ ઘડવું.

- વિશેષ જ્ઞાન અને કૌશલ્યો વિકસાવવા.
- માધ્યમિક બાદની શૈક્ષણિક સંસ્થાઓ અને ક્ષેત્ર જેને અધિકૃત માને તેવી ક્રેડિટ્સ કમાવી.
- ક્ષેત્ર અધિકૃત પ્રમાણપત્ર અને કારકીર્દિ સાથે સંબંધિત તાલીમ પ્રાપ્ત કરવી.
- ઓન્ટારિયો સ્કૂલ્સ પાસપોર્ટ દ્વારા નોંધાયેલ આવશ્યક કૌશલ્યો અને કાર્યની આદતો વિકસાવવી.
- કારકીર્દિના લક્ષ્યાંકો ઓળખવા, શોધવા અને સુધારવા તથા તેના ભાવિ વિશે માહિતગાર નિર્ણયો લેવા.
- જો તેમના લક્ષ્યાંકો અને આયોજનોમાં ફેરફાર થાય તો માર્ગોની વચ્ચે અદલાબદલી કરવાના વિકલ્પ સાથે સ્થિતિ પ્રમાણે રહેવું.

સ્પેશિયાલિસ્ટ હાઈ સ્કૂલ્સ મેજર્સ કઈ રીતે અધિકૃત બને છે?

જેઓ સફળતાપૂર્વક SHSM પૂરું કરે તેવા વિદ્યાર્થીઓ આ મેળવે છે:

- અલંકૃત લાભ સીલ સાથે ઓન્ટારિયો માધ્યમિક શાળા ડિપ્લોમા
- SHSM રેકર્ડ જે તેમની/તેણીની સિદ્ધિની નોંધ કરે
- તેમની/તેણીની ઓન્ટારિયો વિદ્યાર્થી ટ્રાન્સક્રિપ્ટ પર ઔપચારિક અધિકૃતતા.

સ્પેશિયાલિસ્ટ હાઈ સ્કૂલ્સ મેજર્સ ક્યાં આપવામાં આવે છે? હું વધુ માહિતી કેવી રીતે મેળવી શકું?

2012-13માં SHSM કાર્યક્રમો સમગ્ર પ્રાંતમાં તમામ શાળા બોર્ડમાં ઉપલબ્ધ છે. શું ઉપલબ્ધ છે તે વિશે વધુ માહિતી માટે, આપના શાળાનાં આચાર્ય અથવા આપના શાળાનાં બોર્ડ ખાતે સ્ટુડન્ટ સક્સેસ લીડરનો સંપર્ક કરો. SHSMs વિશે અને તે કઈ રીતે કામ કરે છે તે વિશે વધુ વિગતવાર માહિતી અહીં મળી શકે છે www.ontario.ca/studentssuccess.

ontario.ca/EDUparents